

સમભાવનો પ્રલાવ

ક્રેખક : ગિરિશકુમાર પરમાનંદ શાહ, 'કલ્પેશ'

અજ્ઞાન અને મોહને કારણે બાધ્ય વસ્તુઓમાં સાતુકૂળ અને પ્રતિકૂળ મનોવૃત્તિ થતાં રાગ અને દ્રોષ ઉત્પન્ન થાય છે. "આવી મનોવૃત્તિ એજ સંસાર અને તેનો ક્ષય એજ મોક્ષ" માટે આત્મસુખના અલિતાપીએ સર્વવિધનોનો દઢતાથી સામનો કરી મનને રાગદેખરહિત સમભાવવાળું અનાવવું જોઈએ અને સહી સમભાવમાં રહેવા પ્રયત્ન કરવો જોઈએ; કારણું કે ક્ષપકશ્રેણી પર ચઢવાને માટે સમભાવ એજ ઉત્તમ ઉપાય છે. જેણે આત્મનિશ્ચય કર્યે છે તે જ આવી ઉત્તમ સમભાવશ્રેણી ઉપર આગળ વધી શકે છે. "સમભાવે આત્માને જેણે ભાવ્યો છે તે કોઈ પણ સંપ્રદાયનો હોય તો પણ મુક્તિ પામે છે- તેમાં સહેલ નથી." કારણું કે જેણી સતત ધ્યાનદશા વર્તતી હોય તે જ શ્રેષ્ઠ સમત્વને ધારણું કરી શકે છે.

જ્યાં સુધી મનના સંકલ્પ વિકલ્પ ટળતાં નથી ત્યાં સુધી સમતા આવતી નથી. પરન્તુ જ્યારે જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી અહંકૃતિ અને મમતા જતાં, મનેગુપ્તિના યથાર્થ પરિપાલનથી વાસનાનો ક્ષય થાય છે ત્યારે જ સમતા પ્રગટે છે. પછી સચ્ચરાચર જગતની બાધ્ય વસ્તુઓમાં ઈષ્ટાનિષ્ટ, પ્રિયાપ્રિય, હેઠાપાદ્ય આદિ વિકલ્પ કલ્પનામાં રહેતી નથી. રાગદેખ થતો નથી. ઉદ્ઘાચીન પરિણામે વિષયો લોગવાતા હોવા છતાં નવા કર્મો બંધાતા નથી, પણ ઉદ્ઘયમાં આવતા પૂર્વકર્માને સમભાવે વેહવાથી સવિશેષ નિર્જરા જ થાય છે. સમભાવથી બાધ્ય પહોર્ણી મળતાં હર્ષ થતો નથી તેમજ તે જતાં શોષક પણ થતો નથી. માન-અપમાન, સ્તુતિ-નિર્ધાર, જીવિત-મરણાદિ સાતાવેહનીયજન્ય સુખ અને અસાતાવેહનીય-જન્ય હુદાખાના પ્રસંગમાં પણ મનની એકરૂપતા રહે છે તથા શત્રુમિત્ર પ્રત્યે પણ "વાસી ચંહનકલ્પવૃત્તિ" રહે છે. આગળ વધતાં લવ અને મોક્ષમાં પણ જોહાયુદ્ધ રહેતી નથી. કારણું કે સમભાવથી જ પરમાનંદની પ્રાપ્તિ થાય છે તથા નિર્વિકલ્પહશાના સુખને અનુભવતાં સમયનું પણ લાન રહેતું નથી. સમભાવના આવા અનુભવગર્ભ મહિમાને તો ચોગીએ પણ વર્ણવી શકતા નથી.

સમભાવથી નિશ્ચત અનેલું મન વોર ઉપરાંગેમાં પણ ચલાયમાન થતું નથી. આવી નિશ્ચતાથી જ અનેકલવકૃત શુભાશુભ કર્મનો નાશ થાય છે. સમતાથી અહિંસાની સિદ્ધિ થતાં વૈરભાવનો ત્યાગ થાય છે. સમતાવંત પ્રત્યે પ્રાય: કોઈ વૈરભાવ રાખતું નથી. કઢાચ વૈરભાવ હોય તો પણ સમતાના પ્રલાવે ટળી જય છે. એટલું જ નહિ પણ સુમતાધારીના સાનિધ્યમાં ચિંહ, સર્પ બગેરે કુર જીવો શાન્ત થઇ જય છે અને ગાય-વાધ, હંસ-અલિલાડી, સર્પ-મયૂર વિ. પરસપરના જલતિવૈરને પણ વિસરી જય છે. સમભાવવાળા ચોગીની સંગતથી તે ઉપરેશ ન આપે તો પણ કોણાદિ હોષેનો ક્ષય થવાથી મન અત્યંત નિર્મણ બને છે અને સમતામાં પ્રવર્તન થાય છે. સમભાવથી મનોલય થતાં વિષયથહુશૂન્યતા આવે છે. રાગાદ્વિતિમિરનો નાશ થતાં સમભાવની શલાકાથી જ જીવ અને કર્મ પૃથ્રક-પૃથ્રક થાય છે, નિર્મિત માત્રમાં કરોડો જનમનાં કર્મો અખી જય છે અને પરમાત્માનું સ્વરૂપ પ્રકાશે છે. સમભાવથી જ કેવળજ્ઞાનાદિ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તથા અવિચિત સુખ અને પરમપદ પણ તેનું જ ઝણ છે. અધ્યાત્મમશાલ્કોનો વિસ્તાર પણ મોહાનિતું નિવારણ કરી સમભાવને જ પ્રગટ કરવા માટે છે- ૬૬ કરવા માટે છે.

સંતોને સમતા જ ખ્યારી લાગે છે. કારણું કે જ્યાં સમતા છે ત્યાં સુક્ષ્મિત્ર એ. માટે મમતાનો ત્યાગ કરી સમતાનો આદર કરવો જોઈએ. તપ, જપ વગેરે સર્વ કિયાએ સમતા લાવવા માટે જ છે. સમતા જ શિવસુખની વેલડી છે. સમતાને ધારણું કરનારા પુણ્યાત્મા છે, મહાભાગ્યશાલી છે.

વસ્તુતા: સુક્ષ્મિત્ર પણ સમતાના હાથમાં જ છે, કારણું કે જ્યાં સુધી મન રાગદેખાદિ દોષયુક્ત હોય ત્યાં સુધી આર્તરૌદ્રવ્ય હુર્ગાદિકારક અપ્રેશસ્ત ધ્યાનપરંપરા ચાલ્યા જ કરે છે. લાવચારિત્રદ્રવ્ય સમતાના અલાવે અલાંયજીવો પણ દ્રવ્ય ચારિત્ર લઈને નવ અવેચક સુધી જય છે પણ સંસાર-સસુદ્ધને તરી શકતા નથી, અર્થાતું સમતા વિના ત્રણું કાળમાં સુક્ષ્મિત્ર પણ નથી.

જ્યારે જ્ઞાનના પરિપાકૃત્ય સમભાવનું અવદાન લેવામાં આવે છે ત્યારે કર્માને નિર્મૂળ કરનાર, મોક્ષના સાધનરૂપ પ્રશ્નસ્ત ધ્યાન ઉત્પન્ન થાય છે એટલે સમભાવ જ સહૃદ્યાનનું પ્રધાન અંગ છે. તેથી “ધ્યાન પણ સમભાવ રૂપ જ છે અને સમભાવ એ જ ઉત્તમ ધ્યાન છે.”—આમ ધ્યાન અને સમભાવનો કૃથચિતું અસેહ હોવાથી સમભાવનો આધાર ધ્યાન પર અને ધ્યાનનો આધાર સમભાવ પર છે. ક્ષયોપશમ અવસ્થામાં અપેક્ષાએ ધ્યાન અને સમભાવ અને કિયારૂપ ઘટે છે. પણ જ્ઞાન પછી આવી સૂક્ષ્મ કિયા કરનાર જગતમાં વિરલા જ હોય છે. ધ્યાન અને સમતારૂપ સૂક્ષ્મ કિયાથી અનંતું કર્મવર્ગાણુંઓનો નાશ થાય છે અને અનેક કર્મપ્રકૃતિઓ મૂળમાંથી જ ટળી જાય છે. તેનાથી જ ક્ષણે ક્ષણે આત્મસુખ વેહાય છે. શુક્લધ્યાનનું સામર્થ્ય પ્રગતે છે અને આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. પછી ક્ષાયિકજ્ઞાન થતાં સમતારૂપ ભાવચાસ્ત્રમાં મનની કિયાની આવશ્યકતા રહેતી નથી, તેથી તેરમા ગુણુસ્થાનકે ડેવલીને ફૂકત દ્રવ્યમન હોય છે, ભાવમન રહેતું નથી.

દૂંકમાં આત્મજ્ઞાનનું ઇણ સમતા છે. તે જ ભાવચાસ્ત્ર છે, તે જ આનંદરૂપ છે, અને મોક્ષનું કારણ છે. સમતાથી વીર્યાન્તરાય કર્માનો ક્ષયોપશમ થવાથી વીર્યોદલાસમાં વિરોધ વૃદ્ધિ થાય છે અને અતે આત્મા ક્ષપકશ્રેણું આરોહીને મોક્ષ પામે છે.

મનોવૃત્તિએ ચંચળ છે, જ્યારે આત્માનું શુદ્ધ સ્વરૂપ સ્થિર છે. તેથી આત્માના શુદ્ધ સ્વરૂપમાં ઉપયોગ હેતા મનની સ્થિરતા થાય છે, રાગદેખની પરિણાતિનો નાશ થાય છે અને સમભાવદ્વારા પ્રગતે છે. જ્યારે આ આત્મા પોતાને ઔદ્ધારિક, તૈજસ્સુ અને કાર્માણું એ ત્રણે શરીરથી બિન્ન તથા રાગદેખમોહથી રહિત અને સમસ્ત પરદર્શ્યો તથા પર્યાગીથી વિલક્ષણ જાણે છે, બિન્ન સ્વરૂપ નિશ્ચય કરે છે ત્યારે જ તે સમભાવમાં સ્થિર થાય છે. માટે કામકોણોથી વિરક્ત થઈ, શરીરની આસક્તિ છોડી સમભાવનું સેવન કરવું જોઈએ.

સમભાવના પ્રકારે જીવનમુક્તદ્વારા અનુભવાય છે, જે તેરમા ગુણુસ્થાનકે સચોગી ડેવળીને તથા અપેક્ષાએ ક્ષાયના ઉપશમાદ લાવે સમભાવરૂપ અમૃતનો લેશ હોવાથી યોથા ગુણુસ્થાનકે પણ ઘટે છે. જ્યારે બાકીના ઉપર ઉપરનાં ગુણુસ્થાનોમાં શુક્લ શુક્લ પરિણામથી સમભાવરૂપ અમૃતની ઉત્તારોત્તાર વૃદ્ધિ થતી જાય છે—આમ સમભાવના અસંખ્ય લેઢો છે. તેમાંથી સર્વોચ્ચ સમત્વની પ્રાપ્તિ થતાં પૂર્ણાગી બનાય છે. પૂર્વે મરુદેવી ભાતા, લરતચક્રવર્તી, પ્રસન્નચંદ્ર રાજ્ઞી, ચિલાતીપુત્ર વગેરે અનેક લભ્યાત્માઓ ધ્યાન અને સમતારૂપ સૂક્ષ્મ કિયાથીજ મોક્ષ પામ્યા છે. એજ રીતે અનેક લુચો વર્તમાનમાં મોક્ષ પામે છે અને જીવિધમાં પણ પામશે.

માટે શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનથી જગતના સર્વલુચોને સમભાવની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાયો—એજ અભિવાધા.

